



# ફેસબુક અને યુવાપેઢી - સમાજશાસ્ત્રીય સંશોધન

ડૉ. ભાગ્યશ્રી જે. રાજપુત

(મુલાકાતી વ્યાખ્યાતા)

સમાજશાસ્ત્ર વિભાગ  
શ્રી એચ.કે. આટ્ર્સ કોલેજ,  
અમદાવાદ, ગુજરાત

## સાર-સંક્ષેપ

યુવાપેઢી માત્ર શૈક્ષણિક ડીગ્રીઓ હાંસલ કરી વિકસિત નથી બની રહ્યા. પરંતુ તેઓ સોશિયલ નેટવર્ક્સની એપ્સનો ઉપયોગ કરી ડીજીટલ બની રહ્યા છે, એક જ સ્માર્ટફોનમાં તેઓ અનેક એપ્લિકેશન્સ રાખી અનેક લોકો સાથે સતત સંપર્કમાં રહે છે. ગુગલ+, વોટ્સએપ, હાઈક, લાઇન, વી-ચેટ, ફ્લીટર અને ખાસ કરીને ફેસબુકની યુવાનોના અંગતજીવન, કૌટુંબિક જીવન, વિચારશૈલી, ભાષાશૈલી પર વિધાયક કે વિધાતક અસરો થતી હોય છે. ફેસબુક અને આધુનિક યુવાપેઢી એકબીજા સાથે સંકળાઈ ગઈ છે. કોઇપણ સમાજ એવો નહિ હોય કે જે સમાજનો યુવાન ફેસબુક સાથે કનેક્ટ નહિ હોય. આથી ફેસબુક સાથે યુવાપેઢી કેવી રીતે ઓત-પ્રોત છે, તેની અસરો કેવા પ્રકારે છે? તે સમાજશાસ્ત્રીય દ્રાષ્ટિકોણથી તપાસવાનો પ્રયત્ન કરેલ છે.

**ચાવીરૂપ શબ્દો :-** ફેસબુક, યુવાપેઢી, સમાજ, યુવાનો, અસરો, સોશિયલ મીડિયા

## ❖ પ્રસ્તાવના :-

આધુનિક યુગ જેમ-જેમ ટેકનોલોજીકલ રીતે આગળ વધી રહ્યો છે, તેમ યુવાપેઢી વધુ ને વધુ આધુનિક બની ડીજીટલ બની રહી છે. અનેક સોશિયલ નેટવર્ક્સની એપ્લિકેશન્સ એપ જેવી કે, ફેસબુક, ફ્લીટર, લાઇન, હાઈક, વોટ્સએપ, ટીડર વગેરે એપનાં માધ્યમથી યુવાનો જોડાયેલા છે. તેમજ પોતાના અંગત મિત્રો, સગાઓ સાથે ચેટિંગ, સંદેશાઓ-માહિતીની આપ-વે કરતા હોય છે. જેની યુવાનોના અંગતજીવન, કૌટુંબિક જીવન, વિચારશૈલી, ભાષાશૈલી પર વિધાયક કે વિધાતક અસરો થતી હોય છે. ખાસ કરીને ફેસબુકનો ઉપયોગ કરતા યુવાનો પર કેવા પ્રકારની અસરો થઈ રહી છે, તે તપાસવા માટે સમાજશાસ્ત્રીય દ્રાષ્ટિકોણથી સંશોધન હાથ ધરેલ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જાહેરાત માટે કરી શકાય છે; ઉદાહરણ તરીકે, ફેસબુકના ન્યૂઝફીડ પર જાહેરાત મૂકવાથી, તે ઉત્પાદન અથવા

બ્રાન્ડની જગ્યાતિ માટે પ્રોત્સાહિત કરવા માટે વિશાળ સંખ્યામાં લોકો તેને જોઈ શકે છે અથવા તેના ઉપયોગથી વિશિષ્ટ પ્રેક્ષકોને લક્ષ્ય બનાવી શકે છે. ત્યારબાદ સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ જાહેરાતને પસંદ કરવા, શેર કરવા અને તેના પર ટિપ્પણી કરવા, સેટેશા મોકલનારા બનવા માટે સક્ષમ છે, કારણ કે તેઓ તેમના મિત્રો અને આગળની બાજુએ જાહેરાતના સેટેશને પસાર કરી શકે છે. (Hillary Heuler) 'સમૂહ-માધ્યમમાં ચાંત્રિક ટેકનોલોજી મહત્વની છે. તે દરેક સમૂહના લોકોને પરસ્પર એકબીજા સાથે સાંકળે છે. તેના દ્વારા સેટેશાઓ, માહિતીની આપ-લે ખુબ જ ઝડપથી, વ્યાપક પ્રમાણમાં સતત થતી જોવા મળે છે. તેનો હેતુ લોકો ઉપર એ રીતે પ્રભાવ પાડવાનો હોય છે કે જેથી લોકો વધુ પ્રમાણમાં માધ્યમોનો વ્યવહારમાં ઉપયોગ કરી શકે.'<sup>1</sup>

૨૦૧૫માં થયેલા એક અભ્યાસ મુજબ, યુએસએમાં ફેસબુક અથવા ડ્રિટરના ફરીંદું વપરાશકર્તાઓ આ નેટવર્કને તેમના સમાચારનો મુખ્ય સ્તોત માને છે, મનોરંજનના સમાચારોને સૌથી વધુ જોવામાં આવે છે. બ્રેક્ઝિંગ ન્યૂઝના સમયમાં, ડ્રિટર યુઝર્સ વાર્તામાં રોકાણ કરે તેવી સંભાવના વધારે હોય છે. કેટલાક કિસ્સાઓમાં જ્યારે સમાચાર કે વાર્તા વધુ રાજકીય હોય છે, ત્યારે વપરાશકર્તાઓ કોઈ ટિપ્પણી અથવા પસંદ સાથે લિક્ક ફેસબુક પર તેમના મંતવ્યો વ્યક્ત કરશે, જ્યારે ડ્રિટર વપરાશકર્તાઓ ફક્ત સાઇટ્સ ફીડ અથવા વેખને રીફ્લીટ કરશે. (Shearer, Elisa; Barthel, Michael; Gottfried, Jeffrey; Mitchell, Amy : 2015) ઓનલાઇન સામાજિક નેટવર્ક્સમાં, પરંપરાગત મીડિયા ગેટકીપર્સની ગેરહાજરીને કારણે સમાચારની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા ઓછી થઈ શકે છે. (Peck, Andrew : 2020)

"યુવા-આકાંક્ષાઓ એટલે યુવાનોની અંગત, કૌટુંબિક, લગ્ન, શૈક્ષણિક, આર્થિક, રાજકીય કે કળા-કારીગરી એમ કોઈ પણ ક્ષેત્રે અન્ય કરતા કંઈક અલગ કરવાની અદ્યા ઈચ્છાઓ. આ ઉપરાંત યુવા-આકાંક્ષાઓમાં શહેરીકરણ, પશ્ચિમીકરણ, આધુનિકીકરણ, જુદા-જુદા સમૂહ-માધ્યમોનાં સાધનો મહત્વનો ભાગ ભજવે છે."<sup>2</sup>

અવનવી ટેકનોલોજી તથા યુવાઓ પ્રતે ખુબ જ જાણકારી મેળવવાની ધગશાથી જ આ સંશોધન કાર્ય હાથ ધર્યું છે. સોશિયલ મીડિયા દ્વારા સામૂહિક સાંસ્કૃતિક વિનિમય અને આંતરસંસ્કૃતિક સેટેશાવ્યવહારની મંજૂરી આપવામાં આવી છે. વિવિધ સંસ્કૃતિકોમાં વિવિધ મૂલ્ય પ્રાણાલીઓ, સાંસ્કૃતિક માળઘું, વ્યાકરણ અને વિશ્વના દૃષ્ટિકોણો હોવાને કારણે, તેઓ પણ અલગ રીતે વાતચીત કરે છે. જેનો પ્રભાવ યુવાનોમાં થતો જોવા મળે છે. ("AMPU Guide: Common Cross-cultural Communication Challenges") યુવા સેટેશાવ્યવહારની રીતને પ્રભાવિત કરતું અન્ય વલણ હેશટેગ્સનો ઉપયોગ છે. ડ્રિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની રજૂઆત સાથે, માહિતીને સરળતાથી ગોઠવવા અને શોધવા માટે આ હેશટેગ બનાવવામાં આવ્યું હતું. જ્યારે લોકો કોઈ હિલયાલની હિમાયત કરવા માંગતા હોય, ત્યારે સામગ્રીને સ્ટોર કરવા અથવા ભાવિ ઉપયોગ માટેની ડ્રિટ્સ, અને અન્ય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને હાલના હેશટેગ્સનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ ચળવળ વિશેની ચર્ચામાં ફાળો આપવા દેતા હોય ત્યારે હેશટેગ્સનો ઉપયોગ કરી શકાય છે. ઓનલાઇન કોઈ વસ્તુની હિમાયત કરવાની રીત તરીકે હેશટેગ્સનો ઉપયોગ કરવાથી વધુ લોકો માટે વિશ્વભરમાં તેની સ્વીકૃતિ સરળ અને વધુ સુલભ બને છે. (Saxton, Gregory D.; Niyirora, Jerome N.; Guo, Chao; Waters, Richard D. : 2015). ફેસબુકને યુવાનો કેટલું મહત્વ આપે છે? તેમજ આધુનિક યુગમાં ઈન્ટરનેટનાં માધ્યમથી ફેસબુકની યુવાપેઢી

<sup>1</sup> રાજપૂત ભાગ્યશ્રી (૨૦૧૮), 'સમૂહ-માધ્યમો અને યુવાનો', ગ્રીન ફ્લેગ ફાઉન્ડેશન, સાબરકાંઠા. પા.નં. - ૧૬

<sup>2</sup> રાજપૂત ભાગ્યશ્રી (૨૦૧૮), 'યુવા અંગ્રેઝો', આચ્યુત પ્રકાશન, અમદાવાદ પા.નં. ૭

પર કેવી અસરો વર્તાય છે, તેમના કૌટુંબિક જીવન, અંગત જીવન, વિચારશૈલી, સંપૂર્ણ જીવનશૈલી પર ફેસબુકની કેવી અસરો થાય છે? તે જાણવું ખુબ જ અગત્યનું છે.

#### ❖ સંશોધનનાં મુખ્ય હેતુઓ :-

1. યુવાનો કેટલા સમયથી ફેસબુકનો ઉપયોગ કરે છે? તે જાણવું.
2. ફેસબુકનો ઉપયોગ કરવાની પ્રેરણા કોની પાસેથી મળી? તે જાણવું.
3. ફેસબુક પ્રોફાઈલ ઈમેજ વિશેની જાણકારી મેળવવી.
4. યુવાનો ફેસબુક પર કેટલા મિત્રો ધરાવે છે? તે જાણવું.
5. ચેટિંગ કરતી વખતે તેઓ કેવી લાગણી અનુભવે છે? તે જાણવું.
6. ફેસબુક દ્વારા તેઓ સાથે કોઈપણ પ્રકારની છેતરપિડી થઇ છે કે નહિ? તે જાણવું.
7. ફેસબુક વિશે કેવા કાયદા હોવા જોઈએ? તે સંદર્ભે યુવાપેઢીનાં મંતવ્યો જાણવા.

#### ❖ અભ્યાસ ક્ષેત્ર :-

પ્રસ્તુત સંશોધન યુવાનોના સંદર્ભમાં છે, આથી યુવાન કોને કહેવા તે અગત્યનું છે. 'જે યુવાન યુવક અને યુવતી ૧૫ થી ૨૫ વર્ષ સુધીની વયજૂથ ધરાવતા હોય તેનો સમાવેશ યુવાજગતમાં કરી શકાય, આ ઉપરાંત યુવાજગતનાં વ્યાપક અર્થમાં યુવાનોનો શારીરિક, માનસિક વિકાસ, સક્ષમતા, જાગરૂકતા, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક પાસાઓ વધુ મહત્વના બને છે.'<sup>3</sup>

અભ્યાસક્ષેત્રના સંદર્ભમાં જોઈએ તો, સંશોધક પોતે અમદાવાદ શહેરની રહેવાસી છે, આથી ફેસબુકની યુવાનો પર કેવા પ્રકારની અસરો થાય છે? તે માટે અમદાવાદી યુવાનોને તથા અમદાવાદ શહેરને જ અભ્યાસ ક્ષેત્ર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. "જે યુવાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમદાવાદ શહેર સાથે સંબંધ ધરાવતાં હોય, ઉપરાંત યુવાનોનું રહેઠાણ, શિક્ષણ, વ્યવસાય, મોજ-શોખ, ખાણી-પીણી તેમજ સમગ્ર જીવનશૈલી અમદાવાદ શહેર સાથે જોડાયેલી હોય, તેવાં યુવાનોને 'અમદાવાદી યુવાઓ' કહી શકાય."<sup>4</sup>

#### ❖ નિદર્શા પસંદગી તથા અભ્યાસ પદ્ધતિ :-

ફેસબુક અને યુવા પેઢી- સમાજશાસ્ક્રીય સંશોધનમાં અમદાવાદ શહેરના યુવાનોને જ ઉત્તરદાતા તરીકે પસંદ કરેલ છે. આથી જે યુવાનો ફેસબુકનો ઉપયોગ કરતા હતા તેવા જ યુવાનોને ઉત્તરદાતા તરીકે પસંદગી આપેલ છે. આકસ્મિક રીતે મળી ગયેલા મારા ઉત્તરદાતાઓને મુલાકાત અનુસૂચી પદ્ધતિ દ્વારા પ્રશ્નો પૂછ્યા છે. શરૂઆતમાં આકસ્મિક રીતે ચાર યુવા-ઉત્તરદાતાઓની મુલાકાત લીધી, તેમાં મુલાકાતીઓ માટેના સ્થળ સોસાયટી, યુનિવર્સિટીનું કેમ્પસ, બગીચા વગેરે છે. ઉપરાંત આ જ ઉત્તરદાતાઓએ અન્ય યુવાનોનો સંપર્ક કરાવ્યો કે જેઓ ફેસબુકનો ઉપયોગ કરતા હતા. આથી સ્નો બોલ ટેક્નિક (Snow Ball Technique) દ્વારા એક પછી એક


<sup>3</sup> રાજપૂત ભાગ્યશ્રી (૨૦૧૮), 'સમૂહ-માધ્યમોનો યુવાનો પરનો પ્રભાવ', ગ્રીન ફ્લેગ ફાઉન્ડેશન, સાબરકાંદા પા.નૂ. - ૫૮

<sup>4</sup> રાજપૂત ભાગ્યશ્રી (૨૦૧૮), 'અમદાવાદી યુવાનોની આકંક્ષાઓ', આયુધ પ્રકાશન, અમદાવાદ પાન નં- ૭

ઉત્તરદાતાઓ મળતા ગયા, આ રીતે આકસ્મિક નિદર્શા પ્રયુક્તિ અને સ્નો બોલ ટેક્નિક (Snow Ball Technique)નો ઉપયોગ કરી મુલાકાત અનુસૂચી દ્વારા રેફ યુવતીઓ અને ૩૮ યુવકો એમ કુલ ૬૪ યુવા ઉત્તરદાતાઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

#### ❖ માહિતીનું વર્ગીકરણ :-

ફેસબુક જેવી એપનો ઉપયોગ મોટાભાગના યુવાનો કરે છે પરંતુ તે એપનો ઉપયોગ કરવાની પ્રેરણા કોણી પાસેથી મળી? તે જાણવું આવશ્યક છે.



પ્રાપ્ત થયેલ આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે, જે યુવા-ઉત્તરદાતાઓ ફેસબુક એપનો ઉપયોગ કરે છે, તેમાંથી સૌથી વધુ તર યુવક અને ૧૫ યુવતી ઉત્તરદાતાઓને તેમના અંગત મિત્રો પાસેથી પ્રેરણા મળી છે. યુવાવસ્થામાં બંધાયેલી મિત્રતા જીવનમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. આથી યુવાનો આ અવસ્થા દરમિયાન જે કોઈપણ કાર્યો કે કાંડ કરતા હોય તેમાં મિત્રોની ભૂમિકા મહત્વની હોય છે. આ ઉપરાંત ફેસબુક અને ડ્રીટર સમાચારને વધુ ભાગીદારીનો અનુભવ બનાવે છે, કારણ કે લોકો સમાચાર લેખો શેર કરે છે અને અન્ય લોકોની પોસ્ટ્સ પર ટિપ્પણી કરે છે. રેની અને વેલમેન (૨૦૧૨) એ દલીલ કરી છે કે હવે મીડિયા નિર્માણ એક ભાગીદારીનું કામ બની ગયું છે. (Rainie, Lee & Wellman, Barry : 2012) દ યુવતીઓ તથા ૩ યુવક ઉત્તરદાતાઓને તેમના ભાઈ પાસેથી ફેસબુક વાપરવાની પ્રેરણા મળી. મોટેભાગે વ્યક્તિનો મોટોભાઈ જે વસ્તુ વાપરે કે કોઈ નવું કાર્ય હાથ ધરે તો, તેના જેવું જ નાના ભાઈ-બ્હેન કરતા હોય છે. ભારતીય સમાજમાં મોટોભાઈ એ પિતા સમાન ગણાય છે. આથી અહીં ફેસબુકનો ઉપયોગ મોટોભાઈ કરે તો, નાના ભાઈ-બ્હેન પણ તેમના જેવું જ શીખે છે. આ એક પ્રકારનું સમાજીકરણ કહી શકાય.

ફેસબુકનો ઉપયોગ કરતા યુવાનો અનેક જાણી કે અજાણી વ્યક્તિઓના સંપર્કમાં આવે છે તથા તેઓ સાથે ચેટિંગ પણ કરે છે. તેઓ કલાકો સુધી ફેસબુક પર જ સમય વિતાવે છે. સોશિયલ મીડિયાની અસર પરના એક અભ્યાસ મુજબ, કિશોરો પર ફેસબુકની ભાવનાત્મક અસર થતી હોવાનું નોંધાયું છે. જે 'ફેસબુક ડિપ્રેશન' છે. તેઓ પોતાનો મોટાભાગના સમયમાં ફેસબુક પર જ વ્યસ્ત રહે છે. (O'Keefe Schurgen, Gwen. Clark-Pearson,

Kathleen:2011) ફેસબુક એ યુવાનો માટે વિચારોની, લાગણીની અભિવ્યક્તિ કરવાનું એક સાધન છે, તેમ કહી શકાય. ફેસબુકની ટિપ્પણીઓથી લઈને ઇન્સ્ટાગ્રામ પરની પસંદ સુધીની, યુવાનો કેવી રીતે વાતચીત કરે છે, અને સામાજિક રૂપે જે સ્વીકાર્ય છે તે હવે સોશિયલ મીડિયા પર આધારિત છે. (Anderson, Monica; Jiang, Jingjing : 2018). આવેખીય માહિતી પરથી જોઈ શકાય છે કે, સૌથી વધુ ૨૨ યુવકો અને ૧૪ યુવતીઓ એમ કુલ ૩૬ (૫૬.૨%) યુવા-ઉત્તરદાતાઓ ફેસબુક દ્વારા ચેટિંગ કરતી વખતે સારી લાગણી અનુભવે છે. જ્યારે ૨ યુવકો અને ૧ યુવતી એમ કુલ ૩ (૪.૭%) ઉત્તરદાતાઓ એવા છે કે જેઓ, ચેટિંગ કરતી વખતે કોઇપણ પ્રકારની લાગણી અનુભવતા નથી. આ પરથી કહી શકાય કે, યુવાપેઢી મિત્રો કે સગાઓ સાથે ચેટિંગ કરતી વખતે સારી લાગણી અનુભવે છે, પણ તેમ છતાં ચેટિંગ કરતી વખતે લાગણી, પ્રેમ, હુંફનો અભાવ જોવા મળે છે. ફેસબુક દ્વારા થતી ચેટિંગ એ પરોક્ષરૂપે હોવા છતાં પ્રત્યક્ષ હોવાનો આભાસ કરાવે છે, તેમ છતાં યુવાનો વચ્ચેની લાગણીમાં ફુન્ઝિમતા દેખાય છે.

હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ દર્શાવે છે કે ઘણી વખત નકારાત્મક પરિણામો જોવા મળે છે, કારણ કે ફેસબુકના ઉપયોગને નીચા સ્તરે સુખાકારી સાથે જોડવામાં આવી છે; ફેસબુકના ઉપયોગને કારણે માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. (Cramer, Emily M.; Song, Hayeon; Drent, Adam M. : 2016) કમ્યુટર્સ ઇન હુમન બિહેવિયરના લેખ મુજબ, નભળા માનસિક સ્વાસ્થ્યની આ લાગણીઓને લોકોએ તેમના ફેસબુક એકાઉન્ટ્સમાંથી સમય કા ટોવા માટે સૂચવવા સૂચવ્યું છે; આ કિયાને "ફેસબુક થાક" કહેવામાં આવે છે અને તાજેતરના વર્ષોમાં તે સામાન્ય છે. (Shakya, Holly B.; Christakis, Nicholas A. : 2017)

(ટેબલ – ૩ ફેસબુક પર સૌથી વધુ શું પસંદ છે? તે દર્શાવતું કોષ્ટક)


ક્રમ	વિગત	યુવક	યુવતી	કુલ	ટકા
૧	ચેટિંગ	૧૪	૮	૨૨	૩૬.૬
૨	ફોટો જોવા	૫	૬	૧૧	૧૭.૧
૩	પ્રોફાઇલ	૧	૧	૦૨	૩.૧૨
૪	કમેન્ટ	૫	૨	૦૭	૧૦.૮
૫	નવા મિત્રો બનાવવા	૬	-	૦૬	૮.૩૭
૬	જુના મિત્રો શોધવા	૧	૩	૦૪	૬.૨૫
૭	ફોટો અપલોડ કરવા	૨	-	૦૨	૩.૧૨
૮	મેસેજ	૨	૩	૦૫	૭.૮૧
૯	ગેમ	૧	-	૦૧	૧.૫૬
૧૦	બધુજ	૧	૩	૦૪	૬.૨૫
	કુલ	૩૮	૨૬	૬૪	૧૦૦

ઉપર્યુક્ત દર્શાવેલ કોષ્ટકીય વર્ગીકરણ પરથી સમજી શકાય છે કે, કુલ ઉત્તરદાતાઓમાંથી સૌથી વધુ ૨૨ (૩૬.૬%) યુવા ઉત્તરદાતાઓને ચેટિંગ કરવાનું ખૂબ જ પસંદ છે. તેમાંથી યુવતી ઓ કરતાં યુવકોનું પ્રમાણ વધુ જોવા

મળ્યું ફેસબુક પર ચેટિંગ કરવાનું પસંદગી ધરાવનાર કુલ ૧૪ યુવકો અને ૮ યુવતીઓનો સમાવેશ થયેલ છે. આ પરથી કહી શકાય કે, યુવા-ઉત્તરદાતાઓ માટે ફેસબુક એ ચેટિંગ કરવા માટેનું માધ્યમ છે. કે જેના દ્વારા વ્યક્તિ પોતાના અંગત કે દુરના મિત્રો સાથે, સગાઓ સાથે માહિતી-સદેશાની આપ-વે ચેટિંગ દ્વારા કરી શકે છે. તેમજ સતત અને ઝડપથી સંપર્ક કરી શકે છે. માત્ર ૧ જ યુવક ઉત્તરદાતા એવા છે કે જેઓને ફેસબુક પર આવતી અવનવી ગેમ્સ રમવી પસંદ છે. જ્યારે ૧ યુવક અને ૩ યુવતી એમ કુલ ૪ (૬.૨%) યુવા-ઉત્તરદાતાઓ એવા છે કે જેઓને ફેસબુકમાં બધું જ પસંદ છે. એટલે કે, તેઓને, ફેસબુકમાં ચેટિંગ કરવી, ફોટાઓ જોવા, મિત્રો કે સગાઓની પ્રોફાઇલ જોવી, કમેન્ટ કરવી, નવા મિત્રો બનાવવા, જુના મિત્રોને ફેસબુકનાં માધ્યમથી શોધવા, ફોટા અપલોડ કરવા, મેસેજ કરવા તથા ગેમ રમવી એમ ફેસબુક સાથે સંકળાયેલ બધા જ ફીચર્સનો ઉપયોગ કરવો પસંદ છે. ફેસબુક એ પ્રથમ મોટા પાયે સામાજિક નેટવર્કમાંનું એક હતું. ફેસબુક અસરમાં, ડેવિડ કિર્કપટ્રીકે જણાવ્યું હતું કે ફેસબુકની રચના તેના "નેટવર્ક ઇફ્ક્ટ્સ" ને કારણે તેને બદલવા મુશ્કેલ બનાવે છે. ૨૦૧૬ સુધીમાં, એક અંદાજ મુજબ યુ.આસ. ની ૪૪ ટકા વસ્તી ફેસબુક દ્વારા સમાચાર મેળવે છે. (The Economic Times : 2016.) કોષ્ટકીય માહિતી પરથી જોઈ શકાય છે કે, કોઇપણ યુવતીઓને ફેસબુક પર નવા મિત્રો બનાવવા, ફોટાઓ અપલોડ કરવા કે ગેમ રમવી પસંદ નથી. એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે, ભારતીય સમાજ આજેપણ મહિલાઓ પર અમુક પ્રકારની પાંખ્યાંથી રાખે છે. મહિલાઓ નવા મિત્રો બનાવવા માંગતી હોય, ફોટા અપલોડ કરવા માંગતી હોય કે ઓનલાઈન ગેમ રમવા માંગતી હોય પરંતુ સમાજ-પરિવારના નિયંત્રણના કારણે યુવતીઓ સ્વતંત્ર બનીને પોતાની મરજીનું કરી શકતી નથી. જ્યારે યુવકો સહેલાઈથી ફેસબુકનાં માધ્યમથી નવા મિત્રો બનાવી શકે, ફોટા અપલોડ કરી શકે છે. જે યુવક અને યુવતીઓ વચ્ચેની અસમાનતા જ દર્શાવે છે. આ પરથી કહી શકાય કે, આધુનિક યુવાપેઢી સમાજને આધુનિક બનાવી રહી છે સાથે-સાથે ટેકનોલોજીના બધા જ ફીચર્સનો ઉપયોગ કરી, વધુ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. તેમ ઇતાં સમાજના ધોરણો, મૂલ્યો, નિયંત્રણો હાવી હોવાના કારણે ટેકનોલોજીનો વપરાશ કરતા યુવાનો માનસિક ગુલામ છે.

ડેનાહ બાયડ (2011) ના જણાવ્યા મુજબ, ચોક્કસ સોશ્યલ નેટવર્કિંગ સેવાઓ પ્રત્યેની લોકોની ધારણાને આકાર આપવા માધ્યમો મોટી ભૂમિકા ભજવે છે. જ્યારે માય સ્પેસ સાઇટ જોઈએ ત્યારે, પુષ્ટ વયના લોકોએ સમજવા લાગ્યા કે સાઇટ કિશોરોમાં કેવી લોકપ્રિય બની રહી છે, યુવા ભાગીદારી અને સાઇટનો ઉપયોગ કરીને તેમને સંભવિત સંભવિત જોખમો સાથે ન્યૂઝ મીડિયા ભારે ચિંતિત થઈ ગયું છે. પરિણામે, કિશોરોએ સંકળાયેલા જોખમો (દા.ત. બાળ શિકારી અને નિયંત્રણના અભાવ) ને કારણે સાઇટમાં જોડાવાનું ટાયું હતું, અને માતાપિતાએ સાઇટને જાહેરમાં નિદા કરવાનું શરૂ કર્યું હતું. આખરે, સાઇટને ખતરનાક તરીકે લેખલ કરવામાં આવ્યું હતું, અને ધણાને સાઇટ સાથે વાતચીત કરવાથી દૂર કરવામાં આવ્યા હતા. (Boyd, Danah : 2011). ફેસબુકનું માધ્યમ એવું છે કે જેની વ્યક્તિના અંગત જીવન પર ગંભીર અસરો પડે છે. ચેટિંગ દરમિયાન મિત્રો સાથે અણાખનાવ થાય તો પણ વ્યક્તિ ગુસ્સો કરે, હતાશ-નિરાશ બની જાય કે ઝડપો કરવા લાગે. કોંધિત કે ભાવનાત્મક ચેટિંગ ઇન્ટરનેટની બહાર વાસ્તવિક દુનિયાની ક્રિયાપ્રતિક્રિયા તરફ દોરી શકે છે, જે વપરાશકર્તાઓને જોખમી પરિસ્થિતિઓમાં મૂકી શકે છે. કેટલાક વપરાશકર્તાઓને ઓનલાઈન હિસાના જોખમોનો અનુભવ થયો છે અને આ ધમકીઓથી ઓનલાઈન પોતાની અંગત બાબતોને ફેલાવાનો ભય રહે છે. જેમ કે, સાયબર ધમકી, ઓનલાઈન છેડ્ટી, સતામણી, ટ્રોલિંગ વગેરે જેવા ગુનાઓમાં વધારો થાય છે. આઈ-સેફ ફાઉન્ડેશનના સાયબર ધમકાવનારા આંકડા ઘનુસાર, અડધાથી વધુ કિશોરો અને કિશોરોને ઓનલાઈન ધમકાવવામાં આવ્યા છે. ("Cyber Bullying Statistics". July 7, 2015.)

પ્રસ્તુત સંશોધનના સંદર્ભમાં ફેસબુક પર ઓનલાઈન હોય તો અન્ય વ્યક્તિ તમને ખલેલ પહોંચાડે તો ચુવાનો કેવો પ્રતિભાવ આપે છે? તે વિશેની માહિતી મેળવવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, સૌથી વધુ ૨૪ (૩૭.૫%) ચુવા-ઉત્તરદાતાઓ એટલે કે ૧૪ ચુવકો અને ૧૦ ચુવતીઓને અન્ય વ્યક્તિ ખલેલ પહોંચાડે તો તો તેઓ ગુસ્સો કરે છે. ફેસબુક સાથે જોડાયેલા ચુવાનો પોતાના મિત્રો સાથે એટલા બધા ઓતપ્રોત થઇ જાય છે કે, પોતાના પરિવારના સભ્યો બોલાવે, કે ઓનલાઈન ચેટિંગ દરમિયાન ખલેલ પહોંચાડે તો તેઓ ગુસ્સો કરે છે. આ પરથી કહી શકાય કે, ચુવાપેઢી માટે પોતાના પરિવારના સભ્યો કરતા ફેસબુક પરના મિત્રો વધુ મહત્વના બની રહ્યા છે. એક નવા જ સામાજિક સંબંધો રચાઈ રહ્યા છે. જે ભારતીય સમાજનાં માળખાને જડમૂળથી બદલી નાખવામાં સક્ષમ બની રહેશે.



સંશોધન નાં સંદર્ભમાં ચુવા-ઉત્તરદાતાઓના મત મુજબ, ફેસબુક વિશે કેવા કાયદા હોવા જોઈએ, તે માટેની માહિતી એકત્રિત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૩૫.૬% ચુવા-ઉત્તરદાતાઓએ ફેસબુકનાં માધ્યમથી કોઈ પ્રકારનો ગેરઉપયોગ ન થાય તેવા કાયદા અમલમાં મુકવાનું જણાવેલ છે. મોટેભાગે કેટલાક કાયદા માત્ર કાયદાપોથીમાં જ રહી જાય છે, જ્યારે કોઈ ગુના બને તો ગુનેગાર ને સજા આપવામાં અને નિર્દોષને વ્યાય આપવામાં ધણું મોડું થઇ જતું હોય છે. ભારતીય સમાજમાં પહેલેથી જ કેટલીય સામાજિક સમસ્યાઓ વ્યાસ છે. તેમાયે હવે ફેસબુકનાં માધ્યમથી સાઈબર કાઈમ, ઓનલાઈન છેડટી, ચુવતીઓના ફોટા જાણ વિના અપલોડ કરવા વગેરે જેવા બનાવો બને છે. આથી ચુવાપેઢી એવા કાયદા ધરવાનું સૂચન કરે છે કે, જેથી ફેસબુકનો ગેર-ઉપયોગ ન થાય તથા ચુવાનો સલામતી અનુભવે. સંશોધનમાં સમાવિષ્ટ માત્ર એક જ ચુવક ઉત્તરદાતાએ ૧૪ વર્ષથી નીચેની ઊંમરનાં બાળકો ફેસબુકનો ઉપયોગ ન કરે તેવા કાયદા અમલમાં મુકવાનું જણાવ્યું છે. તેમજ ૮ ચુવક ઉત્તરદાતાઓ એ અશ્વીલતા અટકાવવા માટેના કાયદા હોવાનું જણાવ્યું છે.

નોર્ચ, ડેનમાર્ક, ફિનલેન્ડ, અને સ્વીડનમાં મોટા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ સ્વૈચ્છિક (વેબસાઈટ બ્લોક કરવાનો કાયદા સરકારે ધરવો ન પડે તે માટે) રીતે પોલીસ દ્વારા આદેશ કરાયેલી કેટલીક વેબસાઈટોને બ્લોક કરી છે. માનવામાં આવે છે કે આ બધી વેબસાઈટ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી હશે. આ સાઈટના કન્ટેનરને ગુમ રાખવામાં

આવ્યું છે.<sup>5</sup> સાયબરસ્લેકિંગ (Cyberslacking) કોર્પોરેટ માટે ગંભીર ખતરો બની રહ્યું છે. પેનીસુલા બિઝનેશ સર્વિસ દ્વારા કરાયેલા સર્વ મુજબ ઈંગ્લેન્ડમાં કર્મચારીઓ સરેરાશ રીતે કામ દરમિયાન 57 મિનિટ જેટલો સમય વેબસર્ફિંગ કરવા માટે ગાળે છે. (Scottman.com News- Misuse of the net against a small firm in the city)

ફેસબુકનો ઉપયોગ કરતા ૨૧.૮% યુવાનોના પરિવાર નકારાત્મક મંતવ્ય ધરાવે છે. ૭ યુવક અને ૭ યુવતીઓનાં જણાવ્યા મુજબ, તેઓ ફેસબુકનો ઉપયોગ કરે છે, તે તેમના પરિવારને ગમતું નથી, તેમજ ધણીવાર ફેસબુક ન વાપરવા વિશે જણાવીને સંઘર્ષ કે નાની-મોટી મતભેદ થતા હોવાનું જણાવેલ છે. ભારતીય સમાજમાં આજેપણ વડીલો દ્વારા જીવનસાથી પસંદગીને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે આધુનિક યુવાપેઢી ફેસબુકનાં માધ્યમથી પોતાના માટે જીવનસાથી પસંદગી કરશે કે નહિ, તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમ ૭૫% યુવા ઉત્તરદાતાઓએ ફેસબુકનાં માધ્યમથી જીવનસાથી પસંદગી કરવાની ઈચ્છા નથી રાખતા. જ્યારે ૧૦.૮% યુવા ઉત્તરદાતાઓ ફેસબુકનાં માધ્યમથી જ જીવનસાથી પસંદ કરવાનું સૂચવે છે. બાકી રહેલ ૧૪ % યુવા ઉત્તરદાતાઓ કેવીરીતે જીવનસાથી પસંદ કરશે તે વિશે હજુ નક્કી નથી, તેમ જણાવેલ છે. ફેસબુક પર શેર કરવામાં આવતા વિચારો, ફોટોઓ કેટલીક વાર ફેસબુક યુર્ઝર્સ દ્વારા જાહેર રાખવામાં આવે છે, જ્યારે કેટલાક લોકો ગુમ પણ રાખે છે. ગોપનીયતા અધિકારના હિમાયતીઓ સોશિયલ મીડિયા પરના વપરાશકર્તાઓને તેમના વ્યક્તિગત ડેટાના સંગ્રહ વિશે ચેતવણી આપે છે. ઇવેક્ટ્રોનિક ટ્રેકિંગ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ દ્વારા વપરાશકર્તાની જાણકારી અથવા સંમતિ વિના કેટલીક માહિતી મેળવે છે. ડેટા માઇનિંગ તકનીકોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા ઇન્ટેલિજન્સ દ્વારા, કાયદાના અમલ અને સરકારી હેતુ માટે ડેટા પણ એકત્રિત કરી શકાય છે. (Jones, Harvey; Soltren, José Hiram : 2005). અમેરિકન ઇકોનોમિક રિવ્યૂના 2020 ના પ્રાયોગિક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ફેસબુકને નિષ્ણિય કરવાને કારણે વ્યક્તિલક્ષી સુખાકારીમાં વધારો થયો છે. (Allcott, Hunt; Braghieri, Luca; Eichmeyer, Sarah; Gentzkow, Matthew : 2020). આ પરથી કહી શકાય કે, ફેસબુકના વધુ પડતા વપરાશના કારણે આધુનિક યુવાપેઢીનાં અંગત જીવન, ભાષા, પહેરવેશ, બોલી, શિક્ષણની સાથે સાથે વગ્ર સંસ્થામાં પણ પરિવર્તન આવી રહ્યું છે.

#### ❖ સંશોધનનાં મુખ્ય તારણો :-

- પ્રસ્તુત અભ્યાસમાં ઉત્તરદાતા તરીકે યુવક અને યુવતી બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૨૬ યુવતીઓ અને ૩૮ યુવકો છે.
- કુલ ઉત્તરદાતાઓમાંથી પઢ અપરિણીત અને ૧૧ ઉત્તરદાતાઓ પરિણીત છે.
- સૌથી વધુ ૭૩.૪% યુવા ઉત્તરદાતાઓને ફેસબુકનો ઉપયોગ કરવાની પ્રેરણા મિત્રો પાસેથી મળી છે.
- જે ઉત્તરદાતા ફેસબુક પર ઓનલાઈન હોય તે સમયે અન્ય વ્યક્તિ ખલેલ પહોંચાડો તો તેઓ ગુસ્સો કરે છે.
- ફેસબુકનો ઉપયોગ કરતી વખતે નેટવર્ક એરર આવે કે નાપસંદ વ્યક્તિના મેસેજ આવે તો યુવા ઉત્તરદાતાઓ પરેશાની અનુભવે છે.
- મોટાભાગના ઉત્તરદાતાઓ ફેસબુક પર પોતાના અંગત વિચારો રજુ કરતા નથી.

<sup>5</sup> "Finland Censorship Anti-Censorship See". The register. 2006-07-17. Retrieved 2007-08-18.

- માત્ર ૪ ઉત્તરદાતાઓએ અન્ય વ્યક્તિના ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ મેસેજ જોવા માટે, અંગત માહિતી મેળવવા માટે કે ફોટો અપલોડ કરવા માટે ઉપયોગ કરેલ છે.
- મોટાભાગનાં ચુવા ઉત્તરદાતાઓ ફેસબુક પર ૧ કલાક થી ૪ કલાક સુધીનો સમય વ્યતિત કરે છે.
- મોટાભાગના ઉત્તરદાતાઓ ફેસબુક વિશેનાં કાયદા જાણતા નથી.
- સંશોધનમાં સમાવિષ્ટ કરેલ એક જ ઉત્તરદાતા સાથે ફેસબુકનાં માધ્યમથી છેતરપિડી થઇ છે.
- ૧૮.૮% જેટલા ચુવા-ઉત્તરદાતાઓને ફેસબુક લોગ આઉટ કર્યા બાદ ફરીથી લોગ-ઇન કરવાનું મન થાય છે.
- સૌથી વધુ ૩૫.૯% ચુવા-ઉત્તરદાતાઓએ ફેસબુકનાં માધ્યમથી કોઈ પ્રકારનો ગેરઉપયોગ ન થાય તેવા કાયદા અમલમાં મુકવાનું જણાવેલ છે.
- ૨૧.૬% ઉત્તરદાતાઓ ફેસબુકને માત્ર ટાઈમપાસ સમજે છે.

#### ❖ ઉપસંહાર :-

આજનો ચુવા ચુવા-ચુવા છે. ચુવાઓ ઇચ્છે તો કોઇપણ એપને મશહૂર કરી શકે છે, કાં તો પોતે એ જ એપ દ્વારા મશહૂર બની શકે છે. ફેસબુક એક એવી જ એપ છે કે, જેની શોધ માર્ક ઝુકરબર્ગ નામના ચુવાને કરી છે. સમગ્ર ચુવાપેઢીને એક નવી જ રાહ બતાવનાર ફેસબુક ચુવા-જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. માત્ર ચુવાનો જ નહિ, પરંતુ બાળકો, મોટી ઉંમરના સ્ત્રી-પુરુષો બધા જ સ્માર્ટફોન-ઇન્ટરનેટની સાથે-સાથે ફેસબુકનાં રંગ રંગાઈ ગયા છે. આજના વ્યક્તિની સવાર ફેસબુક ઓપન કરવાની સાથે શરૂ થાય છે અને રાત ફેસબુક બંધ કરવાની સાથે જ થાય છે, તેમ કહેવામાં જરાય અતિશાયોક્તિ નથી જ. ફેસબુકનાં માધ્યમથી માનવજીવન, ખાસ કરીને ચુવા-જીવન વધુ સરળ અને ઝડપી બન્યું છે. વિચારશૈલી આધુનિક બની છે. કૌટુંબિક સંબંધો, જ્ઞાતિગત સંબંધો, ધાર્મિક કે રાજકીય સંબંધો વધારવા માટે કે વિઘેરવા, નવી સામાજિક સમસ્યાઓમાં વધારો કરવા માટે પણ ફેસબુકનો જ ઉપયોગ થતો જોવા મળે છે. ચુવાનો ફેસબુકનાં માધ્યમથી અજાણ્યા લોકો સાથે મિત્રતા કરી રહ્યા છે જેને કારણે ચુવાનોને નુકશાની પણ વેઠવી પડતી હોય છે. તેમજ ચુવાનો સેક્સ રિલેટેડ ફોટાઓ, વિડીયો જુએ છે, જે ખરેખર ખોટું નથી, પરંતુ લોકો તેને નકારાત્મક બાબત ગણે છે. વ્યક્તિ દ્વારા જીવામાં આવતા અશ્વીલ ફોટા કે વિડીયો દ્વારા વ્યક્તિની ઇચ્છાઓ તૃસ થઇ જાય છે, પરંતુ ફેસબુક કે અન્ય માધ્યમથી સેક્સ વિડીયો કે ફોટા જોયા બાદ અશ્વીલ વર્તણૂક કરવી ગુનો બને છે. જે સમાજ માટે હાનીકારક છે અને નવી સામાજિક સમસ્યાઓ જન્માવે છે.

વ્યક્તિ પોતાના મોજ-શોખ, વૈવાહિક જીવનની નાની-મોટી ઘુશીઓ, કુટુંબની પરંપરાઓ પણ ફેસબુકના માધ્યમથી અભિવ્યક્ત કરે છે. પ્રોફેસર વેરી ડી રોઝને જણાવ્યું હતું કે ફેસબુક પર કિશોરો વધુ નકારાત્મક વલણ દર્શાવે છે, જ્યારે ચુવાન પુષ્ટ લોકો અસામાજિક વર્તન, ઘેલણા અને આકમકતાના સંકેતો બતાવે છે. સકારાત્મક અસરોમાં ઓનલાઇન મિત્રો પ્રત્યે "વર્યુઅલ સહાનુભૂતિ" ના સંકેતો શામેલ છે અને અંતર્મુખી વ્યક્તિઓને સામાજિક કુશળતા શીખવામાં મદદ કરે છે. (Usigan, Ysolt : 2011). ચુવાઓ જે રીતે ફેસબુક સાથે એકમય બની ગયા છે, તે પરથી તો એમ ચોક્કસપણે કહી શકાય કે, ચુવાપેઢીને વધુ આધુનિક અને વધુ વિકસિત બનાવવામાં ફેસબુક એપનો અગ્રગણ્ય ફાળો રહેલ છે. ફેસબુકમાં દિવસે ન દિવસે આવતા નવા-નવા ફીર્યર્સ આધુનિક ચુવાપેઢીને ક્યાં માર્ગ લઈ જાય છે તે તો જોવું જ રહ્યું.

❖ સંદર્ભસૂચી :-

1. Anderson, Monica; Jiang, Jingjing (28 November 2018). "1. Teens and their experiences on social media". Pew Research Center: Internet, Science & Tech. Retrieved 21 November 2020.
2. Cramer, Emily M.; Song, Hayeon; Drent, Adam M. (November 2016). "Social comparison on Facebook: Motivation, affective consequences, self-esteem, and Facebook fatigue". Computers in Human Behavior . 64 : 739–746. doi : 10.1016/j.chb.2016.07.049 .
3. "Cyber Bullying Statistics". July 7, 2015.
4. "Finland Censorship Anti-Censorship See". The register. 2006-07-17. Retrieved 2007-08-18.
5. Hillary Heuler. "Who really wins out of Facebook's 'Free Internet' scheme for Africa?" . ZDNet.
6. O'Keefe Schurgen, Gwen. Clark-Pearson, Kathleen. (2011) Impact of social media on children, adolescents and families. American Academy of Pediatrics, Volume 127 (Issue 4), 800-805
7. Shakya, Holly B.; Christakis, Nicholas A. (January 16, 2017). "Association of Facebook Use With Compromised Well-Being: A Longitudinal Study". American Journal of Epidemiology . doi : 10.1093/aje/kww189 . PMID 28093386 . S2CID 9926583 . Lay summary – Harvard Business Review (April 10, 2017).
8. Shearer, Elisa; Barthel, Michael; Gottfried, Jeffrey; Mitchell, Amy (July 14, 2015). "The Evolving Role of News on Twitter and Facebook". Pew Research Center's Journalism Project. Archived from the original on October 27, 2019. Retrieved November 17, 2019.
9. Peck, Andrew (2020). "A Problem of Amplification: Folklore and Fake News in the Age of Social Media". The Journal of American Folklore. 133 (529): 329–351. doi:10.5406/jamerfolk.133.529.0329. ISSN 0021-8715
10. Rainie, Lee & Wellman, Barry (April 27, 2012). Networked: The New Social Operating System. ISBN 978-0-262-30040-7.
11. Scottman.com News- Misuse of the net against a small firm in the city
12. "Facebook extends lead as news gateway: Study – The Economic Times". The Economic Times. May 26, 2016. Retrieved May 27, 2016.
13. Usigan, Ysolt (August 29, 2011). "Facebook makes teens narcissistic, anxious and depressed – but also nice, social and engaged". CBS News. CBS. Retrieved December 15, 2017.
14. રાજપુત ભાગ્યશ્રી (૨૦૧૮), 'કેસબુકની યુવાનો ઉપર થતી અસરોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ', ગ્રીન ફ્લેગ ફાઉન્ડેશન, સાખરકાંઠા.
15. રાજપુત ભાગ્યશ્રી (૨૦૧૮), 'સમૂહ-માધ્યમોનો યુવાનો પરનો પ્રભાવ', ગ્રીન ફ્લેગ ફાઉન્ડેશન, સાખરકાંઠા
16. રાજપુત ભાગ્યશ્રી (૨૦૧૮), 'સમૂહ-માધ્યમો અને યુવાનો', ગ્રીન ફ્લેગ ફાઉન્ડેશન, સાખરકાંઠા.
17. રાજપુત ભાગ્યશ્રી (૨૦૧૮), 'યુવા અજ્ઞપો', આચ્યુધ પ્રકાશન, અમદાવાદ
18. રાજપુત ભાગ્યશ્રી (૨૦૧૮), 'અમદાવાદી યુવાનોની આકંક્ષાઓ', આચ્યુધ પ્રકાશન, અમદાવાદ